



ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન
DEPOSIT INSURANCE AND CREDIT GUARANTEE CORPORATION
(રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Wholly owned subsidiary of the Reserve Bank of India)

દાવા પતાવટ વિભાગ

ફેબ્રુઆરી 04, 2020

ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા તમામ વીમાકૃત બેંકોમાં થાપણદારો માટે વીમા કવરેજમાં રૂ. 5 લાખ (રૂ. પાંચ લાખ) સુધીનો વધારો

કૃપા કરીને કેપ્શનવાળા વિષય પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ 4 ફેબ્રુઆરી, 2020ની પ્રેસ રિલીઝ નંબર 2019-2020/1878 નો સંદર્ભ લો. કવરેજ વધારો એવી તમામ વીમાધારક બેંકોને લાગુ પડે છે જે 04 ફેબ્રુઆરી, 2020 થી લિક્વિડેશન/એમાલ્ગમેશન/મર્જર હેઠળ મૂકવામાં આવશે.

2. મહેરબાની કરીને એ નોંધ લેશો કે જે બેંકોની નોંધણી પહેલાથી જ રદ કરવામાં આવી છે અને નિયમનકાર દ્વારા જેનું લાયસન્સ 04 ફેબ્રુઆરી, 2020 પહેલા રદ કરવામાં આવ્યું છે, તે બેંકો માટે વધેલા વીમા કવચ આવી લાગુ થશે નહીં. દાવાઓ સબમિટ કરવામાં આવ્યા હોય (પ્રક્રિયા હેઠળ હોય) અથવા હજુ સુધી સબમિટ કરવાના બાકી હોય તેને ધ્યાનમાં લીધા વિના આવી બેંકોનું ડિપોઝિટ કવરેજ રૂ. 1 લાખ (રૂ. એક લાખ) પર ચાલુ રહેશે. આમાં ફડયામાં ગયેલી એવી બેંકોનો પણ સમાવેશ થાય છે જે મુકદ્દમા હેઠળ છે અથવા જેમની બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACs) ની કલમ 22(5) હેઠળની અપીલો પેન્ડિંગ છે.

(ડી.કે. નલબંદ)
ઉપ મહાપ્રબંધક

પ્રેસ રિલીઝ: 2019-20/ CSD-3

પ્રેસ વિજ્ઞાપન: 2019-20/CSD-3

દાવા પતાવટ વિભાગ

પ્રેસ રિલીઝ (PR)